



CIN # L99999GJ1987PLC009768
Regd. Office : 9/10, GIDC Industrial Estate, WAGHODIA, Dist. : Vadodara
Ph. # 75 748 06350 E-Mail : co_secretary@20microns.com
Website : www.20microns.com

24th January, 2022

TO :

<p>BSE LIMITED Department of Corporate Services Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, MUMBAI – 400 001. SCRIP CODE : 533022</p>	<p>NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED Listing Department Exchange Plaza, Bandra – Kurla Complex, Bandra [East], MUMBAI – 400 051. SYMBOL : 20MICRONS</p>
---	---

Dear Sirs,

Re : Un-audited – Standalone & Consolidated - Financial Results for the Quarter ended 31.12.2021 – NEWS PAPERS’ CUTTINGS.

In continuation of our letter dated 21.01.2022, please be informed that the said results were published inter-alia in the following newspapers :--

1. Economic Times, Ahmedabad &
2. Loksatta, Vadodara

Paper cuttings are sent herewith.

We request you to kindly arrange to take the above on records of the Exchange and acknowledge receipt thereof.

Thanking you,

**Yours faithfully
For 20 Microns Limited**

KOMAL PANDEY Digitally signed by
KOMAL PANDEY
Date: 2022.01.24
10:09:42 +05'30'

**[Komal Pandey]
Company Secretary**

Encl. : as above.

Tweaks to Equalisation Levy Unlikely in Budget

Roadmap to phase out the levy to be worked out after deal with US

Shrimi.Choudhary@timesgroup.com

New Delhi: The government is unlikely to tweak the equalisation levy in the upcoming Union budget. The roadmap to phase out the levy will be worked out in line with the deal with the US which envisages March 2023 as the end date or implementation of the global tax deal.

While announcing the agreement on October 21, 2021, the finance ministry had said the final terms of the deal would be finalised by February 1, 2022. India will provide credit to US compa-

No Change

Google tax rollback over global tax deal comes into force

Budget may provide final terms of India-US agreement on 2% levy

Mechanism to claim tax credit during the interim period

Extension of tax credit (until) to non-US entities

No new tax measures until Dec 31, 2023

There are timelines set for adoption of the global tax deal, which is not happening in the current year, said an official, who did not wish to be identified.

The global tax deal, agreed upon by 138 countries, gives rights to countries, including India, to tax digital players including Microsoft, Google, Facebook and Netflix, besides setting a global minimum corporation tax of 15%. It is to be implemented from 2023.

Under the Pillar One of the global deal, all signing countries are required to withdraw their existing digital services taxes and other relevant similar measures with respect to all companies and also commit not to introduce any new unilateral measures in the interim period.

"There are timelines set for adoption of the global tax deal, which is not happening in the current year, said an official, who did not wish to be identified."

For full report, go to www.economicstimes.com

GUIDELINES FOR RECOVERY OF ARREARS

No Tax Claims After Winding Up Order of Co is Passed: CBIC

Our Bureau

New Delhi: Tax officers can't make any tax claim after the winding up order of a company is passed, the Central Board of Indirect Taxes and Customs has said.

Of arrears and write-offs, to prevent multiple tax authorities initiating the recovery process to minimise the scope for harassment for taxpayers or delay on the part of officials. The circular says that in case of a bankrupt defaulter, tax officers cannot make any claims after the date of winding up order of a company, and

request for claim should be done within 30 days of commencement of liquidation. It also provides a step-by-step procedure for recovery by attachment of property and sale, set-

ting a deadline of six months to complete the process. For recovery of departmental arrears, the circular prescribes that claims can be filed with Debt Recovery Tribunal either through direct application or through SARFESI route to avoid multiple claims and proceedings of the same property



CIN: L99999G1987PLC009768
Regd. Office: 9-10, GIDC Industrial Estate, WAGHODIA, Dist.: Vadodra, 391760, Gujarat, India. Ph.: 75748 06350. Email: co_secretary@20microns.com

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31st DECEMBER, 2021

Table with columns for Sr. No., Particulars, Standalone (Quarter ended), Consolidated (Quarter ended), and Net Profit/Loss. It details financial data for the quarter and nine months ending 31st December 2021.

Notes: 1. The above is an extract of the detailed format of Standalone Financial Results for the quarter and nine months ended on December 31, 2021 and Consolidated Financial Results for the quarter and nine months ended on December 31, 2021 filed with the Stock Exchanges under Regulation 19 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the stock exchanges (www.bseindia.com and www.nseindia.com) and website of our company (www.20microns.com)

For and on behalf of Board of Directors 20 Microns Limited. Place: Waghodia, Vadodra. Date: 21-01-2022



Niti Moots Priority Sector Lending for EVs

Our Bureau

New Delhi: NITI Aayog has proposed inclusion of electric vehicles in the Reserve Bank of India's priority sector lending guidelines, saying the move will help give a significant push to retail lending for EVs.

Banks and non-banking financial companies (NBFCs) in India have a combined financial market size of \$40 billion by 2025 and \$75 lakh crore by 2030, the official think tank said in a report on EVs released on Friday.

"However, retail finance for EVs has been slow to pickup," said the report prepared along with Rocky Mountain Insti-



tute (RMI) and RMI India. It suggested that the central bank may consider various EV segments and use cases based on five parameters: socio-economic potential, livelihood, generation potential, scalability, technological readiness, viability of stakeholder acceptability.

Priority sector lending (PSL) aims to expand financial access and promote employment opportunities in India. "Financial institutions have an important role to play in accelerating the growth of EVs in India and supporting the decarbonisation of road transport," said Anubhita Karri, chief executive officer of NITI Aayog.

Significant Steps Taken to Boost Startups, says Goyal

Government has addressed issues related to angel tax, simplification of tax procedures, self-certification: Union minister for commerce & industry

Our Bureau

Mumbai 15 New Delhi: The government has taken "significant steps" to boost startups, addressing issues related to angel tax, simplification of tax procedures, self-certification, Union minister for commerce and industry Piyush Goyal said.

"What more compliances do you think we can either eliminate, simplify or digitise, what can move to self-certification, what kind of self-regulation mechanisms you can draw?" asked Goyal. He added that 35,500-plus compliances have either been simplified, digitized, or completely removed from the startup ecosystem. "We have the budget coming up soon and all of us are anxiously waiting to see and hear what is done," he added.

The Nansom report said that in 2021, the Indian startup ecosystem raised \$24.1 billion worth of equity investment, of which 6% was raised by 42 companies that became unicorns. In fact, in 2021 startups raised over 60% of what they raised in 2020. As the country saw a massive growth in the number of

startups hubs in the country. Around 20% of the startups in the ecosystem are building solutions for low income groups in the country. The report found that 12.5% of Indian startups are from at least one female cofounder. Almost 36% of female founded startups focus on areas like education, health and retail tech sectors.

Goyal also asked the startup ecosystem to leverage deep tech to build solutions for local and global markets, in the areas of AI, IoT, big data, data analytics, Blockchain, its virtual reality, 3D printing, drones, and tap into the potential of tier two and three cities. Close to 65% of the jobs created by the startup ecosystem have come from unicorns and late-stage startups.

Gold Savings Accounts may be Launched to Check Widening Current Account Deficit

Our Bureau

Kolkata: The government may announce gold savings accounts in the upcoming Budget as a means to discourage the purchase of the metal in its physical form, as it seeks to put a check on widening current account deficit, banking and trade sources said.

Customers can open such gold accounts in banks and put in money on a regular basis, the sources said. They can withdraw the deposit at any time, they said. This is expected to reduce the demand for physical gold as an investment.

It is likely that the gold savings will also get interest, just like the sovereign gold bond. The yearly interest on SGB is 2.5%, -Sitananda Ghosh

NOTICE regarding TSR DARASHAW CONSULTANTS PRIVATE LIMITED (Subsidiary of Link Intime India Private Limited) and its securities.

GLAND PHARMA LIMITED

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

Table with columns for Particulars, Quarter ended (31-Dec-21, 30-Sep-21, 31-Dec-20), and Nine months ended (31-Dec-21, 31-Dec-20, 31-Mar-21). It details financial data for Gland Pharma Limited.

Additional information on Standalone Financial Results is as follows: Table with columns for Particulars, Quarter ended (31-Dec-21, 30-Sep-21, 31-Dec-20), and Nine months ended (31-Dec-21, 31-Dec-20, 31-Mar-21).

Notes: 1. The Unaudited Consolidated Financial Results for the quarter and nine months ended December 31, 2021 ("Unaudited Consolidated Financial Results") of the Company has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on January 21, 2022.

TEERTHANKER MAHAVER UNIVERSITY advertisement for MBBS/BDS admissions, including registration details and contact information.

Hyderabad January 21, 2022

